

**Bank of India BOI** University Road Branch, Vyanktesh Vogue, Indira Circle, 150 Ft. Ring Road, Rajkot - 360 005

**APPENDIX - IV [See rule-8(1)] POSSESSION NOTICE (For Immovable Property)**

Whereas, The undersigned being the Authorised Officer of the Bank of India under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice Dated 06.12.2024 calling upon the Borrower Mrs. Dharmistha Prashant Bhatti (Owner of Secured Asset) to repay the amount mentioned in the notice being Rs. 24,03,425.24/- (Rupees Twenty Four Lakh Three Thousand Four Hundred Twenty Five and Twenty Four Paise) and interest thereon within 60 days from the date of receipt of the said notice.

The Borrower having failed repay the amount, notice is hereby given to the Borrower and the Public in general that the undersigned has taken Possession of property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of Section 13 of Act read with rule 8 of the Security Interest Enforcement Rules, 2002 on this the 07th Day of February of the year 2025.

The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Bank of India for an amount of Rs. 24,03,425.24/- (Rupees Twenty Four Lakh Three Thousand Four Hundred Twenty Five and Twenty Four Paise) and interest thereon.

The Borrower's attention is invited to provisions of sub-section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

**DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY**

All the Pieces and Parcels of Land with Residential Flat Buildings, Sheds & Structures, Fixtures and Fittings Erected or Installed thereon (Both Present and Future) situated at Revenue Survey No. 248P/10P of Ishwaria Village, Plot No. 25 to 34, Sub-Plot No. 25 to 34/1, known as Vraj Bhumi-2, Land Area 4339.42 Sq. Mtrs., Residential Building known Apple Elegance Paiki Apple Yellow, Build up Area 71.38 Sq. Mtr., Sub-District : Paddhari and District : Rajkot, Situated at Apple Yellow, Flat No. A-201, 2nd Floor, Apple Elegance, Near Takshashila Eng. College, Ishwaria Road, Vill. : Ishwaria, Taluka : Paddhari, Dist. : Rajkot - 360110, thereon Bounded as under:

North : Flat No. A-202  
 South : Open to Sky Space after that Apple Green Building  
 East : Common Passage, Stair after that Flat No. A-204  
 West : Open to Sky Space after that Property of Plot No. 25 to 34/2  
 Date : 07.02.2025, Place : Rajkot Authorised Officer, Bank of India

**Bank of India BOI** University Road Branch, Vyanktesh Vogue, Indira Circle, 150 Ft. Ring Road, Rajkot - 360 005

**APPENDIX - IV [See rule-8(1)] POSSESSION NOTICE (For Immovable Property)**

Whereas, The undersigned being the Authorised Officer of the Bank of India under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice Dated 06.12.2024 calling upon the Borrower Umeshbhai Chhaganbhai Thumar (Owner of Secured Asset) to repay the amount mentioned in the notice being Rs. 22,76,209.26/- (Rupees Twenty Two Lakh Seventy Six Thousand Two Hundred Nine and Twenty Six Paise) and interest thereon within 60 days from the date of receipt of the said notice.

The Borrower having failed repay the amount, notice is hereby given to the Borrower and the Public in general that the undersigned has taken Possession of property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of Section 13 of Act read with rule 8 of the Security Interest Enforcement Rules, 2002 on this the 07th Day of February of the year 2025.

The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Bank of India for an amount of Rs. 22,76,209.26/- (Rupees Twenty Two Lakh Seventy Six Thousand Two Hundred Nine and Twenty Six Paise) and interest thereon.

The Borrower's attention is invited to provisions of sub-section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

**DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY**

All the Pieces and Parcels of Land with Residential Flat Buildings, Sheds & Structures, Fixtures and Fittings Erected or Installed thereon (Both Present and Future) situated at Revenue Survey No. 248P/10P of Ishwaria Village, Plot No. 25 to 34, Sub-Plot No. 25 to 34/1, known as Vraj Bhumi-2, Land Area 4339.42 Sq. Mtrs., Residence Building known Apple Elegance Paiki Apple Orange, Built up Area 71.485 Sq. Mtrs., Sub District : Paddhari and District : Rajkot, situated at Apple Orange, Flat No. B-704, 7th Floor, Apple Elegance, Nr. Takshashila Eng. Collage, Ishwaria Road, Village : Ishwaria, Taluka : Paddhari, Dist. : Rajkot, 360110 in the state of Gujarat within the jurisdiction of the Sub-Registrar, Paddhari, thereon Bounded as under:

North : Open to Sky Space afterthat Govt. Waste Land  
 South : Flat No. B-703  
 East : Stair, Common Passage after that Flat No. B-701  
 West : Open to Sky Space afterthat Apple Yellow Building  
 Date : 07.02.2025, Place : Rajkot Authorised Officer, Bank of India

**PUBLIC NOTICE**

That Nimesh Maheshchandra Matilwala have represented before me that he is going to purchase the property known as 'C-Type', Plot No. C-59 admeasuring about 39.96 sq. mtrs. alongwith undivided proportional share admeasuring about 31.55 sq. mtrs. in the internal road and C.O.P., totally admeasuring about 71.51 sq. mtrs. and also construction of residential house made thereon in the housing estate known and named as "Nandanvan Township" constituting land of Sub-Plot No. 4 (as per revised sanctioned plan) of Final Plot No. 4 to 9 (F. P. No. 13, as per T.R) of T. P. Scheme No. 41 (Dindoli) (Block No. 315 to 320 (Revenue Survey No. 214 paikiee) of Moje: Village: Dindoli); City: Surat; Taluka: Choryasi (Now Udhna), District: Surat, from Kailashben Jayeshkumar Rana (Present Owner) and the Present Owner is the sole and absolute owner of the said property and the said property is clear and marketable free from any charge or encumbrance.

That it was further represented by owner's side before me that Original Registration Receipt in respect of Sale Deed registered with the office of the Sub-Registrar of Surat vide Sr. No. 4275 on dt. 10.03.2010 was lost/ misplaced and has not been traceable at present. And, that never ever it was used as security for obtaining any financial assistance by them or anyone else.

Any person or persons, society, institution, group, trust, banks, claiming any right title, interest, claim, charge, lien or mortgage etc. whatsoever are notified to inform us about the same with document any evidence in original within a period of 7 (Seven) days hereof. Failing which it shall be deemed that no person, institutions any charge, encumbrance, claim over the said property or any part thereof and also be deemed that charge, encumbrance, claim, if any, have been waived; And, thereupon, we shall issue Title Clearance Report in respect of the said property, and thereafter no dispute shall not be valid/ entertained, which may be noted.

**Mehul H. Modi (ADVOCATE & NOTARY)**  
 Office : 403, Radhe Krishna Arcade, Adagara Street, Nanpura, Surat.  
 Phone : 98986 90455 (Dtd. 11-02-2025)

**Bank of India BOI** University Road Branch, Vyanktesh Vogue, Indira Circle, 150 Ft. Ring Road, Rajkot - 360 005

**APPENDIX - IV [See rule-8(1)] POSSESSION NOTICE (For Immovable Property)**

Whereas, The undersigned being the Authorised Officer of the Bank of India under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice Dated 14.11.2024 calling upon the Borrowers Sonal Jignesh Trivedi and Jignesh Pravinbhai Trivedi (Owner of Secured Asset) to repay the amount mentioned in the notice being Rs. 23,10,118.14/- (Rupees Twenty Three Lakh Ten Thousand One Hundred Eighteen and Fourteen Paise) and interest thereon within 60 days from the date of receipt of the said notice.

The Borrower having failed repay the amount, notice is hereby given to the Borrower and the Public in general that the undersigned has taken Possession of property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of Section 13 of Act read with rule 8 of the Security Interest Enforcement Rules, 2002 on this the 07th Day of February of the year 2025.

The Borrower in particular and the Public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Bank of India for an amount of Rs. 23,10,118.14/- (Rupees Twenty Three Lakh Ten Thousand One Hundred Eighteen and Fourteen Paise) and interest thereon.

The Borrower's attention is invited to provisions of sub-section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

**DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY**

All the Pieces and Parcels of Land with Residential Flat Buildings, Sheds & Structures, Fixtures and Fittings Erected or Installed thereon (Both Present and Future) situated at Revenue Survey No. 248P/10P of Ishwaria Village, Plot No. 25 to 34, Sub-Plot No. 25 to 34/1, known as Vraj Bhumi-2, Land area 4339.42 Sq. Mtrs., Residence Building known Apple Elegance Paiki Apple Orange, Built up Area 71.485 Sq. Mtrs., Sub District : Paddhari and District : Rajkot, situated at Apple Orange, Flat No. A-903, 9th Floor, Apple Elegance, Nr. Takshashila Eng. Collage, Ishwaria Road, Village Ishwaria, Taluka Paddhari, Dist Rajkot, 360110 in the state of Gujarat within the jurisdiction of the Sub-Registrar, Paddhari, thereon Bounded as under:

North : Flat No. B-902 East : Open to Sky space after that 7-62 Mts. Road.  
 South : Flat No. A-904 West : Common Passage, Lift after that Flat No. A 902  
 Date : 07.02.2025, Place : Rajkot Authorised Officer, Bank of India

**Bank of India BOI** University Road Branch, Vyanktesh Vogue, Indira Circle, 150 Ft. Ring Road, Rajkot - 360 005

**APPENDIX - IV [See rule-8(1)] POSSESSION NOTICE (For Immovable Property)**

Whereas, The undersigned being the Authorised Officer of the Bank of India under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice Dated 29.11.2024 calling upon the Borrower Urmilaben Bipinbhai Solanki (Owner of Secured Asset) to repay the amount mentioned in the notice being Rs. 10,02,220.00/- (Rupees Ten Lakh Two Thousand Two Hundred Twenty and Zero Paise) and interest thereon within 60 days from the date of receipt of the said notice.

The Borrower having failed repay the amount, notice is hereby given to the Borrower and the Public in general that the undersigned has taken Possession of property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of Section 13 of Act read with rule 8 of the Security Interest Enforcement Rules, 2002 on this the 07th Day of February of the year 2025.

The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Bank of India for an amount of Rs. 10,02,220.00/- (Rupees Ten Lakh Two Thousand Two Hundred Twenty and Zero Paise) and interest thereon.

The Borrower's attention is invited to provisions of sub-section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

**DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY**

All the Pieces and Parcels of Land with Buildings, Sheds & Structures, Fixtures and Fittings Erected or Installed thereon (Both Present and Future) situated at A Residential Flat No. 405, Having Carpet Area Adm. Sq. Mtr. 50-00, situated on the Fourth Floor on Building - J of Scheme known as "LIG type housing PMAY" (Pradhan Mantri Awas Yojna), situated on the SEWS Reserve Plot adm. Sq. Mt. 20968.00 of T. P. Scheme No. 27 (Mavdi), F.P. No. 41/A (Shiv Township) of Revenue Survey No. 367/2,3,4,5,6,7 paiki of Village : Mavdi within the limits of Rajkot Municipal Corporation, Rajkot in the State of Gujarat within the Jurisdiction of Sub-Registrar Rajkot - 6, thereon Bounded as under:

North : Internal Road East : Flat No. 406  
 South : Passage & Lift West : Flat No. 404  
 Date : 07.02.2025, Place : Rajkot Authorised Officer, Bank of India

**SAMBHAHV MEDIA LIMITED**  
 (CIN: L67120GJ1990PLC014094)  
 Registered Office: "Sambhaav House", Opp. Judges' Bungalows, Premchandnagar Road, Satellite, Ahmedabad - 380 015  
 Phone: +91 79 2687 3914/15/16/17  
 Email: secretarial@sambhaav.com Website: www.sambhaav.com

**EXTRACTS OF STANDALONE AND CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED ON DECEMBER 31, 2024**  
 (₹ in Lakhs, except per share data)

SN	Particulars	Standalone						Consolidated					
		Quarter Ended		Nine Months Ended		Year Ended	Quarter Ended		Nine Months Ended		Year Ended		
		31-12-24	30-09-24	31-12-23	31-12-24	31-12-23	31-03-24	31-12-24	30-09-24	31-12-23	31-12-24	31-12-23	31-03-24
	(Refer Notes below)	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total Income from Operations (net)	1,014.01	965.78	1,045.69	2,766.52	2,686.69	3,941.66	1,117.25	1,068.02	1,047.19	3,098.86	2,691.94	3,995.70
2	Net Profit/(Loss) for the period from continuing operations (before Tax, Exceptional items)	126.65	62.29	143.27	192.54	(90.83)	105.28	67.47	10.05	145.93	61.88	(94.69)	103.78
3	Net Profit/(Loss) for the period from continuing operations before tax (after Exceptional items)	126.65	62.29	143.27	192.54	(90.83)	105.28	67.47	10.05	145.93	61.88	(102.96)	129.71
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional items)	94.05	30.89	107.88	128.13	(70.79)	117.02	49.73	(8.58)	110.56	30.15	(83.72)	139.98
5	Net Profit/(Loss) from discontinued operations after tax	(17.08)	(4.49)	(69.97)	(25.31)	(78.20)	(81.77)	(17.08)	(4.49)	(69.97)	(25.31)	(78.20)	(81.77)
6	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	76.57	25.91	38.22	101.91	(146.63)	40.29	32.25	(13.36)	41.90	3.93	(159.56)	63.04
7	Equity Share Capital (Face Value of ₹ 1/- per share)	1,911.11	1,911.11	1,911.11	1,911.11	1,911.11	1,911.11	1,911.11	1,911.11	1,911.11	1,911.11	1,911.11	1,911.11
8	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	-	-	6,338.20	-	-	-	-	-	6,414.40
9	Earning per share of ₹ 1/- each (from Continuing and Discontinuing Operations)												
	Basic and diluted EPS before Exceptional items (₹) - Continuing operations	0.05	0.02	0.06	0.07	(0.04)	0.06	0.03	(0.00)	0.06	0.02	(0.04)	0.06
	Basic and diluted EPS before Exceptional items (₹) - Discontinuing operations	(0.01)	(0.00)	(0.04)	(0.01)	(0.04)	(0.01)	(0.00)	(0.04)	(0.01)	(0.04)	(0.04)	(0.04)
	Basic and diluted EPS after Exceptional items (₹)	0.04	0.01	0.02	0.05	(0.08)	0.03	0.00	0.02	0.02	(0.08)	0.03	

The above is an extract of the detailed format of Quarterly and nine month ended Financial Results reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on February 10, 2025 and the same is filed with the BSE Limited and National Stock Exchange of India Limited under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of Quarterly Financial Results and Notes thereto are available on the website of the Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com and also on the Company's website at www.sambhaav.com.

Place : Ahmedabad  
 Date : February 10, 2025

For and on behalf of the Board of Directors  
**Manoj B Vadodaria**  
 Chairman & Managing Director  
 DIN: 00092053

**Markets, Insight Out**

Markets, Monday to Saturday

To book your copy, sms reachbs to 57575 or email order@bsmail.in

કોમોડિટી વાયાદાઓમાં રૂ. ૧૦૫૫૮.૧૬ અને ઓપ્શન્સમાં રૂ. ૬૦૫૮૦.૧૬ કરોડનું ટર્નઓવર

સોના-ચાંદીમાં ઉછાળો : ફૂડમાં સુધારો

સોના-ચાંદીમાં રૂ. ૮૧૫૬.૩૫ કરોડનાં કામકાજ : બુલિયન ઈન્ડેક્સ ૨૦૪૭૦ પોઈન્ટના સ્તરે

મુંબઈ, તા. ૧૦ કોમોડિટી વાયાદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. ૩૭૧૧૫૦.૧૪ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું.



અથવા, રૂ. ૮૪૮૮૮ના આગલા બંધ સામે રૂ. ૮૮૭૭ વધી રૂ. ૮૫૭૮૫ના સ્તરે પહોંચ્યો હતો.

ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે કિલોટોન ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ. ૪૮૭૭ વધી રૂ. ૪૮૫૬૮ના સ્તરે પહોંચ્યો હતો.

રૂ. ૬૨૮૮ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. ૬૩૧૨ અને નીચામાં રૂ. ૬૨૬૦ના મથાળે અથાઈ, રૂ. ૬૨૬૨૩ના આગલા બંધ સામે રૂ. ૬૪૪ વધી રૂ. ૬૩૦૧ના ભાવ થયા હતા.

કમિશનની ભલામણો લાગુ થયાં પછી પગાર વધારો

સરકારી મૂડી ખર્ચમાં વેગ આવશે, એપ્રિલ સુધીમાં ૮ મું પગાર પંચ રચાશે : ખર્ચ સચિવ

નવી દિલ્હી, તા. ૧૦ ખર્ચ સચિવ મનોજ ગોયલને આજ્ઞા છે કે સરકારનો મૂડી ખર્ચ (કેપેક્સ) ગતિ પકડશે અને તેના સંકેતો પહેલાથી જ દેખાઈ રહ્યા છે.

લાગુ કરવામાં સમય લાગે છે, તેથી આ પંચની નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં કોઈ અસર થશે નહીં. કમિશનની ભલામણો લાગુ થયા પછી, પગાર વધારો ૧ જાન્યુઆરી, ૨૦૨૪થી અમલમાં આવશે.

આઈએમએફના તાજેતરના ડેટા અનુસાર અર્થતંત્રમાં મોટા ફેરફારો બેવા મળશે

વર્ષ ૨૦૨૫માં વૈશ્વિક અર્થતંત્રમાં ભારત અને બ્રાઝિલ સૌથી ઝડપથી વિકસતાં અર્થતંત્રો બનશે

નવી દિલ્હી, તા. ૧૦ આઈએમએફના તાજેતરના ડેટા અનુસાર, ૨૦૨૫માં વૈશ્વિક અર્થતંત્રમાં મોટા ફેરફારો બેવા મળશે.

નો વધારો દર્શાવે છે. આ ઉપરાંત, અમેરિકાએ તેનો ડેબ્ટુરો જીપીપી ગુણોત્તર ૧૩૨% થી ઘટાડીને ૧૨૪% કર્યો છે.

ટામેટાંએ ખેડૂતોને રડાવ્યા : પ્રતિ કિલોગ્રામ માત્ર ૩-૫ રૂપિયા મળ્યા

નવી દિલ્હી, તા. ૧૦ આઈએમએફના તાજેતરના ડેટા અનુસાર, ૨૦૨૫માં વૈશ્વિક અર્થતંત્રમાં મોટા ફેરફારો બેવા મળશે.

શે. ભારતનો જીપીપી ૨૦૨૫માં ડોલર ૪.૩ ટ્રિલિયન સુધી પહોંચવાની ધારણા છે, જે ૨૦૨૦ માં ડોલર ૨.૭ ટ્રિલિયન હતો.

શહેરોમાં ખરીદીની આદતો બદલાઈ રહી છે ઈએમઆઈ સપોર્ટથી મોંઘા સ્માર્ટ ઉપકરણો અને ઝવેરાતનું વેચાણ વધ્યું

સુંબઈ, તા. ૧૦ શહેરોમાં ખરીદીની આદતો બદલાઈ રહી છે. મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ ભલે ટીંગણું થઈ ગયું હોય.

છેલ્લાં ત્રણ વર્ષમાં કુલ ૨૫૫ હવાઈ મુસાફરો 'નો ફ્લાય લિસ્ટ'માં સામેલ

નવી દિલ્હી, તા. ૧૦ છેલ્લા ત્રણ વર્ષમાં વિવિધ એરલાઈન્સે કુલ ૨૫૫ મુસાફરોને 'નો ફ્લાય લિસ્ટ'માં સામેલ કર્યા છે.

સરકારે સોમવારે રાજ્યસભામાં માહિતી આપી હતી કે કુલ ૨૫૫ મુસાફરો, ૨૦૨૩ માં ૧૧૦ અને ૨૦૨૨માં ૬૩ મુસાફરો યાદીમાં હતા.

નવરાત્રી અધિકારણ-1 આર.સી. નં. ૨૪૬૦/૨૦૨૫. બિનરિટી ઓફ ફાઈનાન્સ, પ્રીપ્રાઈવેટ ઓફ ફાઈનાન્સીયલ સર્વિસ, ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા. ચોથો માળ, ભીખુભાઈ એમ.એસ. કોચરના આશ્રમ પાસે, એલીસાઈવ, પાલડી, અમદાવાદ - ૩૮૦૦૦૬.

Table with 3 columns: Index Name, Index Value, Index Change. Includes details about the Index Name and Index Value.

નવરાત્રી અધિકારણ-1 આર.સી. નં. ૨૪૬૦/૨૦૨૫. બિનરિટી ઓફ ફાઈનાન્સ, પ્રીપ્રાઈવેટ ઓફ ફાઈનાન્સીયલ સર્વિસ, ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા. ચોથો માળ, ભીખુભાઈ એમ.એસ. કોચરના આશ્રમ પાસે, એલીસાઈવ, પાલડી, અમદાવાદ - ૩૮૦૦૦૬.

Table with 4 columns: Index Name, Index Value, Index Change, Index Info. Includes details about the Index Name and Index Value.

Table with 3 columns: Index Name, Index Value, Index Change. Includes details about the Index Name and Index Value.

મેસર્સ આરજી એન્જીનીયરિંગ લિમિટેડ (ફૂડ ફાઈનાન્સ). સિલિકોન સિટી, ચીથોડા, સીઆઈસી સેક્ટર, મહાકાલિય ઈન્ડિયા ગ્રોવ્સની ઉપર, ન્યુ સિટીલાઇટ રોડ, ભરવાણા-વેડે, સુરત-૩૬૫૦૦૬, ગુજરાત, ભારત. ઈ-મેઇલ: hq.archon@gmail.com

SAMBHAAV MEDIA LIMITED (CIN: LH7120GJ1930P014094). Registered Office: "Sambhaav House", Opp. Judges' Bungalows, Premanchandnagar Road, Satellite, Ahmedabad - 380 015. Phone: +91 79 2687 3914/15/16/17. Email: secretarial@sambhaav.com Website: www.sambhaav.com